

# વ્યૂજ આઈ ગાંધીનગર

## NEWS OF GANDHINAGAR (Daily) દૈનિક

E mail - prdpraval@yahoo.co.uk

\*Editor : Pradip A. Raval (Mo) 98246 53073 \* Block No.677/2, Gh Type, Sector - 8, Gandhinagar (Gujarat)

\* Volume : 6 \* Issue No. 145 \* Date: 24.03.2020 \* Tuesday \* Page :04 \* Rs. 1.00/- \* Annual Rs. 351/-

૪૫ મિનિટ માટે ટ્રેડિંગ રોકવામાં આવ્યું, નિફ્ટીમાં પણ ૧૧૧૦ અંકનો કડાકો

# શેરબજાર કોરોનાગ્રસ્ત: સેન્સેક્સમાં ઐતિહાસિક ૪૦૦૦ અંકોનું ગાબડું

મુંબઈ, તા. ૨૩ ભારતમાં પણ ધીમે ધીમે કોરોના વાઈરસનો વધતો જતો વ્યાપ અને તેના કારણે સરકારે જાહેર કરેલી લોકડાઉનની સ્થિતિને કારણે શેરબજારમાં આજે ખુલતાની સાથે જ ભારે ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતમાં સેન્સેક્સ ૨૮૯૧ અંક ઘટીને કારોબાર કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી ૬૯૪૪ અંક ઘટી ૮૧૧૬ પર કારોબાર કરી રહ્યો હતો. સેન્સેક્સમાં ૧૦ ટકા ઘટાડા બાદ લોઅર સર્કિટ લાગવાને પગલે ટ્રેડિંગ ૪૫ મિનિટ સુધી રોકવામાં આવ્યું હતું, જે ફરીથી શરૂ થયું હતું. પરંતુ તેમાં કોઈ સુધારો જોવા મળ્યો નહોતો. સેન્સેક્સ પર બજાજ ઓટો, એક્સિસ બેંક, માટ્રિ સુગુકી, અલ્ટ્રાટેક સિમેન્ટ



આદનું લોએસ્ટ લેવલ છે. બધા ૫૦ શેર ઘટીને અને ૪ શેર તો ૨૦%થી વધુ ગગડ્યા છે. માર્કેટ બ્રેડ્થ પર નજર કરીએ તો ૧૭૦૩ શેર ઘટીને અને ૧૨૯ શેર વધીને બંધ આવ્યા હતા. સેન્સેક્સમાં ઇતિહાસમાં સૌથી મોટું જબરજસ્ત ૪૦૦૦

હતી કે શું આવી પરિસ્થિતિમાં શેર બજાર થોડાંક સમય માટે બંધ ના કરી દેવું જોઈએ...? સેન્સેક્સ ૧૩.૧૫%, ૩૮૨૩૪ અંક નીચે ૨૫,૮૮૧ના લેવલે બંધ આવ્યો છે. સેન્સેક્સ આજે સોમવારે ડિસેમ્બર, ૨૦૧૬ના તળિયે ક્લોઝ થયો છે. બધા જ સેક્ટોરિયલ ઇન્ડાયસિસ આજે ઘટીને બંધ આવ્યા છે. ૧૧માંથી ૯ સેક્ટોરિયલ ઇન્ડાયસિસ ૧૦%થી વધુ તૂટ્યાં. સેન્સેક્સમાં સમાવિષ્ટ બધા જ ૩૦ શેર ઘટીને બંધ આવ્યા. ૧૯ શેરમાં તો ડબલ ડિજિટ કડાકો. એક્સિસ બેંક, ઇન્ડિયન બેંક, બજાજ ફાઈનાન્સ, ICICI બેંક ૨૦% તૂટ્યાં હતા. ૭%ના કડાકે પુલ્યા બાદ બજારમાં સામાન્ય રિકવરી જોવા મળી રહી હતી પરંતુ, રિલાયન્સ

ભારતીય ચલણ ૭૬.૦૨ની ઐતિહાસિક નીચલી સપાટીએ પુલ્યો હતો જોકે આ લેવલે RBI હસ્તક્ષેપ કરીને રૂપિયાને સપોર્ટ આપી શકે છે, તેમ બજાર એક્સપર્ટ્સ જણાવી રહ્યાં છે. સરકાર અને આરબીઆઈ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં કારણે ગયા સપ્તાહના શુક્રવારે બજાર ભારે વધારા સાથે બંધ થયું હતું. સેન્સેક્સ ૧૬૨૭.૭૩ અંક વધીને ૨૮૯૧૫ અને નિફ્ટી ૪૮૨ અંક વધીને ૮૭૪૯ પર બંધ થયો હતો. જ્યારે અમેરિકાના બજારોમાં ભારે ઘટાડો રહ્યો હતો. ડાઉ જોન્સ ૯૧૩ અંકના ઘટાડા સાથે ૧૯૧૭૪ પર બંધ થયો હતો. નેસ્ડેક કંપોઝિટ ૨૭૧ અંક ઘટીને ૬૮૭૯ પર બંધ થયો હતો. એસએન્ડપી ૧૦૪ અંક ઘટીને ૨૩૦૪ પર બંધ થયો હતો. શેરબજારમાં લાગતી સર્કિટના ફિલ્ટર ત્રણ પ્રકારના છે. પ્રથમ ૧૦ ટકા, બીજો ૧૫ અને ત્રીજો ૨૦ ટકાનો હોય છે. જો ૧૦ ટકાનો ઘટાડો ૧ વાગ્યા પહેલા આવે છે તો બજાર એક ક્લાક માટે બંધ કરવામાં આવે છે. તેમાં શરૂઆતની ૪૫ મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને ૧૫ મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ ૧ વાગ્યા બાદ લાગે છે તો કારોબાર ૩૦ મિનિટ માટે રોકાય છે. શરૂઆતની ૧૫ મિનિટ સુધી કારોબાર સંપૂર્ણ રીતે બંધ રહે છે અને ૧૫ મિનિટનું પ્રી ઓપન સેશન હોય છે. જો સર્કિટ ૨ વાગ્યા પછી લાગે છે તો ટિવસના બાકી બચેલા સમય સુધી કારોબારને રોકવામાં આવે છે.

## સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

### સંસદમાં પણ લોકડાઉન: લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિત કાળ સુધી સ્થગિત



ન્યુ દિલ્હી, તા. ૨૩ દેશમાં કોરોના વાયરસના વધતા જતા પ્રકોપને કારણે ટીએમસી અને શિવસેના સંસદની કાર્યવાહીને અનિશ્ચિત સમયગાળા સુધી સ્થગિત કરી દેવાઈ છે. સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ ડેસ્ટિનિંગના મામલે સર્વપક્ષીય બેઠકમાં સંસદની કાર્યવાહી બાબતે નિર્ણય લેવામાં આવ્યો છે.

સંસદમાં અધિકારીઓને આગ્રહ કરતા કહ્યું હતું કે સંસદની કાર્યવાહીને બંધ કરી દેવી જોઈએ. સંસદનું આ બજેટ સત્રનો બીજો તબક્કો ૩ એપ્રિલ સુધી ચાલવાનો હતો. નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દુષ્યંત સિંહ સિંગર કનિકા કપૂરની પાર્ટીમાં સામેલ થયા હતા. કનિકા કપૂરનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ લખનઉમાં તેની સારવાર ચાલી રહી છે. સૂગોના જણાવ્યા અનુસાર પાર્ટીમાં હાજરી આપ્યા બાદ તેઓ સંસદની કાર્યવાહીમાં પણ પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ ભવનમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ મળ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ કોવિંદ અને ત્યાં સામેલ તમામ નેતાઓએ પોતાના રિપોર્ટ કરાવ્યા હતા. જોકે, સદાગ્યે તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા.

## દેશમાં કુલ આઠ લોકોના મોત મહારાષ્ટ્રમાં વધુ ૧૫ કેસ પોઝિટિવ: દેશમાં કુલ ૪૨૬ કેસ

મુંબઈ, તા. ૨૩ સમગ્ર દેશમાં કોરોના વાયરસના કેસ વધતા જઈ રહ્યા છે. દર્દીઓની સંખ્યા ૪૨૫ થઈ ગઈ છે. કોરોનાની ચપેટમાં આવનારા અત્યાર સુધી ૮ના મોત થઈ ચૂક્યા છે. માત્ર ૨૪ કલાકમાં ૫૦થી વધારે નવા દર્દી આવ્યા છે અને ત્રણ મોત નીપજ્યા છે. દિલ્હી, રાજસ્થાન, બિહાર, પંજાબ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ,

કારણે ત્રીજી વ્યક્તિનું મોત નિપજ્યું છે. મહારાષ્ટ્રમાં કોરોના વાયરસથી ત્રીજું મોત નીપજ્યું છે. મૃતક ફિલિપાઈન્સનો રહેવાસી છે અને તેનું મોત રવિવારે થયું હતું. જોકે પહેલા તે કોરોના પોઝિટિવ હતો પરંતુ બાદમાં નેગેટિવ થઈ ગયો હતો. જે બાદ તેને મુંબઈના કસ્તૂરબા હોસ્પિટલથી પ્રાઈવેટ હોસ્પિટલમાં શિફ્ટ કરાયો હતો. ડોક્ટરોનું કહેવું હતું કે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાના કારણે તેનું મોત નીપજ્યું છે.

## ઈટાલીમાં સૌથી વધુ ૫૪૦૦ મોત, અમેરિકામાં આંકડો ૪૦૦ને પાર

### કોરોનાના આતંક સામે દુનિયા નિ:શબ્દ: કુલ ૧૪૫૦૦થી વધુ લોકોના મોત



અમેરિકામાં પણ કોરોના વાઈરસ ઘૂસી ગયો છે. અહીં રવિવારે ૨૪ કલાકમાં ૧૪,૫૫૦ નવા કેસ સામે આવ્યા છે. અમેરિકામાં અત્યાર સુધી ૩૩,૨૭૬ લોકોને ઇન્ફેક્શન થયું છે. અમેરિકામાં વધુ ૩૯ લોકોના

મોત થતા કુલ મૃત્યુઆંક ૪૫૮ થયો છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના કારણે ચિંતિત છે. કારણકે ચીને સમયસર અમેરિકાને વાઈરસ વિશે જાણ ન કરી. બીજાબાજુ સ્પેનમાં કોરોના વાઈરસે રોડ સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૪૧ લોકોના મોત થતા કુલ મૃત્યુઆંક વધીને ૧૮૧૩ પહોંચ્યો છે. આ ઉપરાંત વધુ ૧,૧૪૧ નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા ૨૯,૮૦૯ થઈ ગઈ છે. ટ્રમ્પે કહ્યું કે, હું ચીનના કારણે થોડો પરેશાન છું. હું તેમની સાથે પ્રમાણિક છું, રાષ્ટ્રપતિ જિનપિંગ અને તેમના દેશનું સન્માન કરું છું. તેમણે અમને આ વિશે જાણ કરવાની જરૂર હતી. અમેરિકાએ ચીનમાં નિષ્ણાત ડોક્ટર્સ મોકલવાની રજૂઆત પણ કરી હતી પરંતુ ચીને કોઈ પ્રતિક્રિયા નહતી આપી. ઈટાલીના સિવિલ પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે

## કોરોના વિરુદ્ધ અમે સરકારનાં પગલાંથી સંતુષ્ટ: સુપ્રીમ કોર્ટ

### સ્વાસ્થ્ય સુવિધાઓ ઉભી કરવી જરૂરી

### કોરોના વાઈરસને હરાવવા માત્ર લોકડાઉનથી નહીં ચાલે: ડબલ્યુએચઓ

લેબને વધારવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી બાદ કોર્ટે કોરોના લેબ ટેસ્ટિંગ સેન્ટર વધારવાની અરજ સરકારને રેફર કરી છે. ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી બેંચે કહ્યું કે, “અમે સરકારનાં પગલાંથી સંતુષ્ટ છીએ. આ સંકટને પહોંચી વળવા માટે ઘણી ઝડપથી પગલાં ઉઠાવવામાં આવ્યા છે. ટીકાકારો પણ માની રહ્યા છે કે સરકારે ટીકાકારોને કામ કર્યું. આ રાજનીતિ નથી તથ્ય છે.” આ બેંચમાં જસ્ટિસ એલ.એન. રાવ અને સૂર્યકાંત સામેલ હતા. સુનાવણી દરમિયાન કોર્ટે વધુ એક મોટો નિર્ણય લીધો છે. હવે જરૂરી સુનાવણી માટે કયા વકીલ સુપ્રીમ કોર્ટ પરિસરમાં જશે તેની જવાબદારી સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનનાં અધક્ષની હશે.

કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. અનેક દેશોએ કોરોનાને ફેલાવતો રોકવા માટે લોકડાઉનની મદદ લીધી છે. લોકોને ઘરોમાં બંધ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન લોકડાઉનને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ઈમરજન્સી એક્સપર્ટ જણાવ્યું કે, કોરોના વાઈરસને ખતમ કરવા માટે દેશ કે સમાજને લોકડાઉન કે બંધ કરવો પુરતું નથી. વાઈરસને ફેલાવતો રોકવા અને તેનાથી બચવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોની આવશ્યકતા છે. એક ઈન્ટરવ્યુમાં ઈમરજન્સી એક્સપર્ટ માર્ક રયાને જણાવ્યું કે, આપણે ખરી રીતે તો તેના પર ધ્યાન આપવાની જરૂર છે કે, જે ફેલાવતો રોકવા માટે લોકડાઉનની મદદ લીધી છે. લોકોને ઘરોમાં બંધ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન તેમને શોધીને તેમને મેડિકલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે તે જરૂરી છે. આમ કરવાથી જ કોરોનાને ફેલાવતો અટકાવી શકાશે. માર્ક રયાને વધુમાં જણાવ્યું કે, લોકડાઉન સાથે સૌથી મોટી સમસ્યા છે કે, જ્યારે લોકડાઉન સમાપ્ત થશે, તો લોકો મોટી સંખ્યામાં લોકો અચાનક

તંત્રી સ્થાનેથી...

નિડરતા સૌથી મોટુ હથિયાર

સમગ્ર દુનિયામાં હાલ કોરોના વાયરસના કારણે ભયના માહોલમાં જીવી રહ્યું છે. અસંખ્ય લોકો આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. આ ખતરનાક વાયરસને આપણે જોઈ શકતા નથી. જેની સામે લડવા માટે આપણી પાસે કોઈ હથિયાર પણ નથી. ત્યારે આવા સમયે ખૂબ જ સાવધાનીપૂર્વક આપણે કામ લેવાની જરૂર છે. બીજી બાજુ સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પણ ડરનો માહોલ ઉભા કરવા માટે સક્રિય છે. લોકોમાં અનેક પ્રકારના ડર ઉભા છે, નોકરી જવાનો ડર, વાયરસના સંક્રમણમાં આવવાનો ડર, ડર છે કે, ક્યાંક લોકડાઉન ન થાય. ડર એ વાતનો છે કે, ક્યાંક આ વાયરસનો શિકાર ન બનીએ. બધુ મળીને એ વાત સામે આવે છે કે, ડર આપણને નબળા પાડે છે. આ ફક્ત મનોવૈજ્ઞાનિક તથ્ય નથી. ડરના કારણે આપણા કિલ્લોવોહી પર ખતરનાક અસર પડે છે. આ ડર આપણી ઈમોશનલ હેલ્થ પર ભારદા કરી નાખે છે. જેના કારણે આપણી પ્રતિરોધ કરવાની ક્ષમતા પર ખૂબ જ અસર પડે છે. હકીકતમાં જોઈએ તો, પ્રતિરોધક સિસ્ટમ અનેક લાખો કોશિકાઓ સાથે મળીને બને છે. જેમાંથી અમુક કોશિકાઓનું કામ હોય છે, બિમારીથી લડવું અને સ્વચ્છ રાખવું. આખા શરીરમાં આ કોશિકાઓ ભ્રમણ કરતી હોય છે. જેને ફાઈટર સેલ્સ પણ કહેવાય છે. એક રીતે જોવા જઈએ તો, આ કોશિકાઓ શરીરમાં સિપાહીઓની માફક હુમલો કરે છે. શરીરમાં કોઈ પણ પ્રકારનો વાયરસ કે બેક્ટેરિયાનો પ્રવેશ થતાં જ તેના પર તૂટી પડે છે. તમે જાણતા જ હશો કે, દરરોજ હજારો વાયરસ આપણા સંક્રમણમાં આવતા હોય છે, પણ તે આપણુ કશું જ બગાડી શકતા નથી, કેમ કે, આ કોશિકાઓ તેને ખાતમ કરી નાખે છે. આપણે આવી કોશિકાઓનો આભાર માનવો જોઈએ, પણ વિચારો કે, જો આ લડાયક કોશિકાઓ જ નબળી પડી જાય તો. અથવા તો ઓછી થઈ જાય તો. ત્યારે આવા સમયે નબળામાં નબળો વાયરસ પણ આપણા પર અટકે કરી શકે છે. આપણે બધાએ એડુસનું નામ સાંભળ્યું હશે. દુનિયાભરમાં તેના કારણે ડરનો માહોલ છે. આ બિમારી ફક્તને ફક્ત પ્રતિરોધક ક્ષમતા નબળી હોવાના કારણે જ થાય છે. વળી પાછા આપણે ડર તરફ આવી તો, ડર આપણા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલને અસંતુલિત કરી ઈમ્યુન સિસ્ટમને ડિસ્ટર્બ કરે છે. પ્રતિરોધક ક્ષમતા જેવી ડિસ્ટર્બ થાય છે, તેની સૌથી પહેલા અસર આ લડાયક કોશિકાઓ પર થાય છે. આ કોશિકાઓ ઓછી થવા લાગે છે. જેમ જેમ આ કોશિકાઓ ઓછી થવા લાગે છે, પ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે. ત્યારે આવા સમયે આપણા શરીરમાં ડર એટલો વધી જાય છે કે, આપણે નક્કી નથી કરી શકતા કે, ડર કઈ વાતનો છે અને કઈ વાતનો ડર નથી. ત્યારે આવા સમયે આપણી લડાયક કોશિકાઓ વધુ નબળી થઈ જાય છે. કુલ મળીને જ્યારે તણાવ, ચિંતા અને ડર પોતાની સીમા પાર કરી લે છે, ત્યારે આઈસોલેશન અને એકલાપણાથી ઘટ્ટકારો મેળવવા માટે કોઈ પ્રયોગ આપણને સૂઝતો નથી, ત્યારે આ લડાયક કોશિકાઓ આપણા શરીરમાં આવતા બેક્ટેરિયા તથા વાયરસને પણ આવતા રોકી શકતી નથી. આવા સમયે સરકારે પણ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગને પોતાની સાથે આ પ્રક્રિયામાં જોડવા જોઈએ. ઉપરાંત આપણી અંદર રહેલી આ લડાયક કોશિકાઓને પણ મજબૂત કરવી જોઈએ. કારણકવગરનો ડર આપણને ખતરનાક પરિસ્થિતિમાં મુકે છે. આમેય વાઈરસની સામે પડતા પહેલા આપણે આપણી જાતને મજબૂત બનાવવી પડશે કારણકે તે મજબૂત હશે તો જ આપણે દુશ્મન પર વિજય મેળવી શકીશું.

આજનું પંચાંગ

વિક્રમ સંવત-૨૦૨૦, શાલિવાહન શક-૧૯૪૧, વીર સંવત-૨૫૪૬, ઈસ્લામીક સંવત-૨૫૪૫, તા. ૨૪/૦૩/૨૦૨૦, મંગળવાર, ફાગણ વદ-૩૦, અમાસ સુવૈધ્ય-૬-૪૮, સુવૈષ્ણ-૬-૫૭, જેન નવકારશી-૭-૫૪, આજની રાશિ : મીન (દ.ચ.ઝ.થ.), નક્ષત્ર: ઉત્તરા ભાદ્રપદ	
સૂર્ય-કુંભ ચંદ્ર-કર્ક મંગળ-ધન બુધ-કુંભ ગુરુ-ધન શુક્ર-મેષ શનિ-મકર રાહુ-મિથુન કેતુ-ધન હાલ-મેષ નેપ્ચ્યુન-કુંભ પ્લૂટો-મકર	- શુભ ચોઘડીયા - ૯-૫૧ થી ચલ-લાભ-અમૃત-૧૪-૨૫ સુધી, ૧૫-૫૬ થી શુભ-૧૭-૨૭ સુધી, ૨૦-૨૭ થી લાભ-૨૧-૫૬ સુધી, ૨૩-૨૫ થી શુભ-અમૃત-ચલ-૩-૫૦ સુધી
	- શુભ હોરા - ૮-૫૦ થી ૧૧-૫૩ સુધી, ૧૨-૫૪ થી ૧૩-૫૪ સુધી, ૧૫-૫૬ થી ૧૮-૫૮ સુધી, ૧૮-૫૮ થી ૨૦-૫૭ સુધી

દૈનિક રાશીફળ

તા. ૨૪-૦૩-૨૦૨૦ મંગળવાર

મેષ (મ.લ.ઈ.) :- સહાયકીય કાળજી રાખવી. આવકનું પ્રમાણ જળવાઈ રહે. વાહન-મકાન સુખ ઉત્તમ. આરોગ્ય સાચવવું.

વૃષભ (મ.વ.ઉ.) :- કૌટુંબિક વાતાવરણ સુમેળભર્યું રહે. અભ્યાસમાં પ્રગતિ, ધર્મ આધ્યાત્મિકક્ષેત્રે રુચિ વધતી જણાય.

મિથુન (ક.છ.ઘ.) :- નાણાંકીય સ્થિતિ મજબૂત બનતી જમાય. રોજગારીની નવી તકો મળે. આવકનું પ્રમાણ રહે.

કર્ક (ક.ઘ.ઇ.) :- રાજકીયપદ પ્રતિષ્ઠામાં વધારો થાય. આરોગ્ય સંભાળવું. પત્નીથી ફાયદો થાય

સિંહ (મ.ટ.) :- રાજકીયપદ-પ્રતિષ્ઠામાં વધારો થાય. કાચદાકીય પ્રશ્નોનો હલ થઈ શકે છે. નાણાભીક દૂર થાય.

કન્યા (પ.ઘ.ઘ.) :- નોકરિયાત વર્ગમાં ઉપરી અધિકારીનું માગદર્શન મળી રહે. આરોગ્ય સંભાળવું.

તુલા (ર.ત.) :- પરદેશથી સુભ સમાચાર મળે. એકંદરે સમય સુભ રહે. અભ્યાસમાં પ્રગતિ. વિદેશથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.

વૃશ્ચિક (ન.ચ.) :- વારસાગત મિલકતોના પ્રશ્નો દૂર થાય. માનસિક ચિંતા હળવી બને. સમય શુભ.

ધન (ભ.ઘ.ફ.ટ.) :- જમીન-મકાન-વાહનના યોગ ઉત્તમ, ધાર્મિક યાત્રા પ્રવાસના યોગ. અભ્યાસમાં પ્રગતિ.

મકર (ખ.જ.) :- ઈષ્ટદેવની ઉપાસનાથી મુશ્કેલીઓ દૂર થાય. કાચદાકીય પ્રશ્નોનો હલ થાય.

કુંભ (ગ.શ.સ.) :- જમીન, વાહન, મકાનના યોગ. આરોગ્ય સુખાકારી, કૌટુંબિક વાતાવરણ સુમેળ ભર્યું બની રહે.

મીન (દ.ચ.ઝ.) :- ઈષ્ટદેવની કૃપાથી મુશ્કેલીમાં રાહત. ધાર્મિકયાત્રા પ્રવાસના યોગ. આરોગ્ય સાચું રહે.

અમદાવાદમાં ૧૩, વડોદરામાં ૬, સુરતમાં ૪, ગાંધીનગરમાં ૪, કચ્છ-રાજકોટમાં ૧-૧ કેસ નોંધાયા  
ગુજરાતમાં કુલ ૩૦ પોઝિટિવ કેસ: લોકડાઉનનો કડક અમલ કરવા આદેશ

ગાંધીનગર, તા. ૨૩

કેન્દ્ર સરકારે આ રોગથી લોકોને બચાવવા ગઈકાલે રવિવારે જનતા કફ્યુનો અમલ કરાવ્યા બાદ મહત્વના ૧૪ દિવસનો સમયગાળો હેમખેમ પસાર થાય તે માટે લોકોને એકબીજાના સંપર્કમાં માથું ઉંચકી રહ્યું છે. રાજ્યમાં અત્યારસુધીમાં ૩૦ નવા કેસ નોંધાયા છે. ગુજરાતમાં કોરોનામાં પહેલું મોત સુરતમાં નોંધાયું છે. ૨૫ માર્ચ સોથી વધારે ૧૩ પોઝિટિવ અમદાવાદમાં, વડોદરામાં ૬, સુરતમાં ૪, ગાંધીનગરમાં ૪ અને કચ્છ તથા રાજકોટમાં ૧-૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સરકાર તેનો વ્યાપ વધતો રોકવા પ્રયાસો કરી રહી છે. જેમાં અમદાવાદ સહિત ૬ શહેરો લોકડાઉન જાહેર કરાયા છે અને લોકડાઉનના અમલમાં લોકોનો સહયોગ નહીં મળતાં જાહેર હિતમાં પોલીસ તંત્રને કડકાઈથી કામ લેવાની સુચના આપવામાં આવી છે. મહાનગરોના પોલીસ દ્વારા વાહનચાલકોને અને લોકોને ચેતવણી આપીને લોકડાઉનમાં બિનજરૂરી રીતે બહાર નહીં નિકળવા કહ્યું છે.

સુરત પાલિકા અને પોલીસ કમિશનરને બહાર નિકળવું પડ્યું હતું. સુરતમાં પણ વેપાર-ધંધા બંધ હોવાથી, લટાર મારવા નીકળેલા લોકોને પોલીસે અટકાવ્યા હતાં. રાજકોટમાં લોકડાઉનની જાહેરાત બાદ પણ શો રૂમ ખુલ્લા રહેતા બંધ કરવાયા હતા.

વડોદરા શહેરમાં નવા ત્રણ પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ અમદાવાદ પછી કોરોનાના સૌથી વધુ કેસ વડોદરામાં થયા છે. ત્રણ નવા કેસ સાથે વડોદરામાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને ૬ થઈ ગઈ છે. ગુજરાતમાં પહેલું મોત નોંધાતાની સાથે જ રાજ્ય સરકાર હરકતમાં આવી છે અને આજથી હાઉસ ટૂ હાઉસ સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવનારી છે. તો કોરોનાની દહેશતના પગલે વિધાનસભા સત્ર સ્થગિત રાખવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જે અંગે આજે વિચારણા થઈ શકે તેમ છે. લોકડાઉન દરમિયાન રાજ્યના છ મહાનગરોમાં બહાર નીકળતા લોકોને પોલીસ અટકાવીને ઘરે પરત મોકલી રહી છે. દરમ્યાન,

લોકોની વરજવરને રોકવા ગુજરાત-રાજસ્થાનની સરહદ સીલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે અમીરગઢ પાસેથી ગુજરાતમાંથી આવેલા ૮૦૦ મુસાફરોને રાજસ્થાનમાં પ્રવેશવા દેવામાં આવ્યાં નહોતા.

સુરત: શહેરમાં ૪ કોરોના વાઈરસના પોઝિટિવ કેસ અને વૃદ્ધનું મોત થયું છે. કોરોનાના વધી રહેલા પ્રકોપના કારણે તેકદારીના ભાગ રૂપે સુરત શહેરને ૨૫ માર્ચ સુધી બંધ રાખવા જિલ્લા કલેક્ટરે આદેશ કર્યો છે. જોકે, લોકો સવારથી રસ્તા પર નીકળી પડ્યા છે. જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા સુરતનો મોટા ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ ને પણ ૩૧ તારીખ સુધી બંધ રાખવા અપીલ કરાઈ છે. જેને લઈ હીરા બજાર અને હીરાના કારખાનાં ૩૧ માર્ચ સુધી બંધ રાખવા એસોસિએશન એ નિર્ણય લીધો છે. જાણે કે જનતા કફ્યુ માત્રથી કોરોના વાઈરસની અસર ખત્મ થઈ ગઈ હોય એ રીતે ગંભીરતા દાખવવાના બદલે બેદરકારીભર્યું વર્તન કરી રસ્તા પર સમૂહમાં ભેગા થનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના પાડિયા વિસ્તારમાં ગઈકાલે સાંજે ૫ વાગે રેલી યોજવા બદલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે.

૩૧ માર્ચ સુધી ગુજરાતના ૬ શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ રાજકોટ, ગાંધીનગર અને કચ્છ લોકો સવારથી રસ્તા પર નીકળી પડ્યા છે. જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા સુરતનો મોટા ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ ને પણ ૩૧ તારીખ સુધી બંધ રાખવા અપીલ કરાઈ છે. જેને લઈ હીરા બજાર અને હીરાના કારખાનાં ૩૧ માર્ચ સુધી બંધ રાખવા એસોસિએશન એ નિર્ણય લીધો છે. જાણે કે જનતા કફ્યુ માત્રથી કોરોના વાઈરસની અસર ખત્મ થઈ ગઈ હોય એ રીતે ગંભીરતા દાખવવાના બદલે બેદરકારીભર્યું વર્તન કરી રસ્તા પર સમૂહમાં ભેગા થનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના પાડિયા વિસ્તારમાં ગઈકાલે સાંજે ૫ વાગે રેલી યોજવા બદલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે.

૩૧ માર્ચ સુધી ગુજરાતના ૬ શહેરો લોકડાઉન જાહેર કરાયા છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર અને કચ્છ રાજકોટ, ગાંધીનગર અને કચ્છ લોકો સવારથી રસ્તા પર નીકળી પડ્યા છે. જેથી પોલીસ અને પાલિકા કમિશનર શહેરના રાઉન્ડ પર નીકળ્યા છે અને લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી રહ્યા છે. સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ દ્વારા સુરતનો મોટા ઉદ્યોગ એટલે હીરા ઉદ્યોગ ને પણ ૩૧ તારીખ સુધી બંધ રાખવા અપીલ કરાઈ છે. જેને લઈ હીરા બજાર અને હીરાના કારખાનાં ૩૧ માર્ચ સુધી બંધ રાખવા એસોસિએશન એ નિર્ણય લીધો છે. જાણે કે જનતા કફ્યુ માત્રથી કોરોના વાઈરસની અસર ખત્મ થઈ ગઈ હોય એ રીતે ગંભીરતા દાખવવાના બદલે બેદરકારીભર્યું વર્તન કરી રસ્તા પર સમૂહમાં ભેગા થનારા લોકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના પાડિયા વિસ્તારમાં ગઈકાલે સાંજે ૫ વાગે રેલી યોજવા બદલ ૬ લોકોની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર છે.

એપ્રિલ સુધીમાં દોઢ કરોડથી વધારે લોકો બેરોજગાર થઈ શકે છે  
કોરોના અસર: અમેરિકાના અર્થતંત્રમાં  
૨૪ ટકા સુધી ઘટાડાની શક્યતા

ન્યૂયોર્ક, તા. ૨૩

કોરોના વાઈરસના પ્રકોપને લીધે અમેરિકાનું અર્થવ્યવસ્થા અનિશ્ચિતતાના માહોલમાં પહોંચી ગયું છે. દેશભરમાં કારોબાર ઠપ્પ થઈ ગયો છે. વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન્યૂયોર્કની સ્થિતિ પણ ચિંતાજનક છે. હવે એ જોવુ મુશ્કેલ છે કે સ્થિતિ કઈ હદ સુધી બગડે છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના મુખ્ય અમેરિકી અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨ ટકા સુધીનો

ઘટાડો થશે. જોકે, ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે બીજા ત્રિમાસિક ગાળાના આંકડા ૨૪ ટકા સુધી જ હોઈ શકે છે. તેમનું એમ પણ કહેવું છે કે વર્તમાન સમયમાં બેરોજગાર થઈ ગયો છે. વ્યવસાયિક અને આર્થિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ન્યૂયોર્કની સ્થિતિ પણ ચિંતાજનક છે. હવે એ જોવુ મુશ્કેલ છે કે સ્થિતિ કઈ હદ સુધી બગડે છે. ઓક્સફોર્ડ ઈકોનોમિક્સના મુખ્ય અમેરિકી અર્થશાસ્ત્રી ગ્રેગ ડેકોનું કહેવું છે કે અર્થતંત્રમાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૦.૪ ટકા અને બીજા ત્રિમાસિક ગાળામાં ૧૨ ટકા સુધીનો



વોશિંગ્ટનના સીએનએન સ્ટુડિયોમાં ડેમોક્રેટિક રાષ્ટ્રપતિની પ્રાથમિક ચર્ચામાં ભાગ લેતા પહેલા ભૂતપૂર્વ વાઈસ પ્રેસિડેન્ટ સેન. બર્ની સેન્ડર્સ, અને આઈ-વીટી કોરોનાના લીધે હાથ મિલાવવાના બદલે કોણીથી એક બીજાનું સ્વાગત કરે છે.



ચેન્નાઈના મુચુકુડુ ખાતે, કોરોનાવાયરસ લીધે નાવડી ની મજા માનનાર લોકો પણ ઓછા થઈ ગયા પછી એક બાજુ પર પાર્ક કરેલ નાવડી જોવા મળે છે.

પાક.માં અત્યાર સુધી ૭૭૬ કેસ કોરોનાના, ૫ મોત  
પાકિસ્તાનમાં લોકડાઉન શક્ય નથી, ૨૫ ટકા  
વસ્તી ગરીબી રેખાની નીચે: ઈમરાન ખાન

ઈસ્લામાબાદ, તા. ૨૩

કોરોના વાયરસને દુનિયાના ૧૯૨ દેશોમાં પગપેસારો કર્યો છે. પાકિસ્તાનમાં કોરોનાના અત્યાર સુધી ૭૭૬ કેસ સામે આવ્યા છે અને ૫ લોકોના મોત થયા છે. વડાપ્રધાન ઈમરાન ખાન દેશને સંપૂર્ણ રીતે લોકડાઉન કરવા માટે તૈયાર નથી. તેમના મુજબ, લોકડાઉન સંભવ નથી. કેમકે દેશની ૨૫ ટકા વસ્તી ગરીબી રેખાની નીચે જીવે છે. વડાપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું કે, સમગ્ર રીતે લોકડાઉનનો અર્થ છે કે- આર્મી અને સરકાર દ્વારા કફ્યું લગાવી દેવો. જેને કારણે

રાખીએ છીએ. સુરક્ષા માટે સોશિયલ ડિસ્ટન્સ, પોતાને ક્વોરન્ટાઈનમાં રાખવાની જરૂર છે. ઈમરાન ખાને સલાહ આપી છે કે ડરવાની કોઈ જરૂર નથી. ડરને કારણે લોકો અનાજનો સંગ્રહ કરશે જેને લીધે અછત સર્જી શકે છે અને પરિણામ બચાવહ આવી શકે છે. અમે સંકટમાંથી બહાર નીકળવાના પ્રયાસ કરી રહ્યા છીએ. ડરને રોકવામાં મીડિયાની પણ મહત્વની ભૂમિકા હશે. તમે પોતાની જવાબદારી નિભાવો અને સાવધાની રાખીને પોતાને અને બીજાને પણ સુરક્ષિત રાખો.



કોરોનાનો ભય: પંજાબે સમગ્ર  
રાજ્યમાં કફ્યું લાગુ કર્યો

રવિવાર રાત્રે ચેપગ્રસ્ટ લોકોની સંખ્યા ૩૬૦ થઈ છે, આ આંકડામાં ૪૧ વિદેશી નાગરિકોનો સમાવેશ લગાવી દેવામાં આવ્યું છે, આ દરમિયાન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે હુકમ આપ્યો છે.

રવિવાર રાત્રે ચેપગ્રસ્ટ લોકોની સંખ્યા ૩૬૦ થઈ છે, આ આંકડામાં ૪૧ વિદેશી નાગરિકોનો સમાવેશ લગાવી દેવામાં આવ્યું છે, આ દરમિયાન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે હુકમ આપ્યો છે.

રવિવાર રાત્રે ચેપગ્રસ્ટ લોકોની સંખ્યા ૩૬૦ થઈ છે, આ આંકડામાં ૪૧ વિદેશી નાગરિકોનો સમાવેશ લગાવી દેવામાં આવ્યું છે, આ દરમિયાન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે હુકમ આપ્યો છે.

રવિવાર રાત્રે ચેપગ્રસ્ટ લોકોની સંખ્યા ૩૬૦ થઈ છે, આ આંકડામાં ૪૧ વિદેશી નાગરિકોનો સમાવેશ લગાવી દેવામાં આવ્યું છે, આ દરમિયાન જરૂરી સેવાઓને છુટ આપવામાં આવી છે, રાજ્યનાં મુખ્ય પ્રધાન અમરિન્દર સિંહે હુકમ આપ્યો છે.

ટોકિયો ઓલિમ્પિક્સ મુલતવી રાખવાનું  
કદાચ અનિવાર્ય બનશે: શિન્ઝો એબે

ટોક્યો, તા. ૨૩

રાખવાનું કદાચ અનિવાર્ય બનશે. ટોકિયો શહેરમાં આવતી ૨૪ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સ યોજવાનું નિર્ધારિત કરાયું છે.


પવિત્ર ઓલિમ્પિક જયોત શ્રીસના એથેન્સ શહેરમાંથી ગયા શુક્રવારે ટોકિયો આવી પહોંચી હતી. ટોચી રીલે (જયોતની રીલે સફર) ૨૬ માર્ચથી યોજવાનું પણ નક્કી કરાયું છે, પરંતુ કોરોનાના ફેલાવાને કારણે ટોકિયો ઓલિમ્પિક્સ-૨૦૨૦ને મુલતવી રાખવા અનિવાર્ય બની શકે છે.

ઈન્ડરનેશનલ ઓલિમ્પિક કમિટી આગામી અઠવાડિયાઓમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ટોકિયો ગેમ્સના આયોજન પર થયેલી અસરોનો અભ્યાસ કરવાની છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જાહેર બંગલુરુનો સમાવેશ થાય છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવા શહેરો છે જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયેલા છે.

રાખવાનું કદાચ અનિવાર્ય બનશે. ટોકિયો શહેરમાં આવતી ૨૪ જુલાઈથી ૮ ઓગસ્ટ સુધી ઓલિમ્પિક ગેમ્સ યોજવાનું નિર્ધારિત કરાયું છે.

પવિત્ર ઓલિમ્પિક જયોત શ્રીસના એથેન્સ શહેરમાંથી ગયા શુક્રવારે ટોકિયો આવી પહોંચી હતી. ટોચી રીલે (જયોતની રીલે સફર) ૨૬ માર્ચથી યોજવાનું પણ નક્કી કરાયું છે, પરંતુ કોરોનાના ફેલાવાને કારણે ટોકિયો ઓલિમ્પિક્સ-૨૦૨૦ને મુલતવી રાખવા અનિવાર્ય બની શકે છે.

ઈન્ડરનેશનલ ઓલિમ્પિક કમિટી આગામી અઠવાડિયાઓમાં કોરોનાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિની ટોકિયો ગેમ્સના આયોજન પર થયેલી અસરોનો અભ્યાસ કરવાની છે અને ત્યારબાદ પોતાનો નિર્ણય જાહેર બંગલુરુનો સમાવેશ થાય છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ એવા શહેરો છે જ્યાં કોરોના વાયરસના પોઝિટિવ કેસો નોંધાયેલા છે.



# કોરોનાએ ભગવાનની ઓળખ કરાવી.....! પણ માનવી સમજશે કે કેમ.....?

(જીએનએસ: હર્ષદ કામદાર) વિશ્વભરમાં કોરોના વાયરસના ૩ લાખથી વધુ કેસ નોંધાય છે. જ્યારે મૃત્યુઆંક ૧૪ હજારથી પણ વધી ગયો છે. ચીનના ૩૫૫ ના મોત થયા છે... સ્પેનમાં ૩૫૫ ના મોત નોંધાય છે. અને ૨૫ હજારથી વધુ પોઝિટિવ કેસ છે. ઈટાલીમાં ૪૦૩૫ પર મૃતક પહોંચ્યો છે, અને ૨૪,૯૨૬ જેટલા પોઝિટિવ કેસ નોંધાય છે. આ બધામાં નોંધનીય બાબત એ છે કે યુરોપીયન દેશોમાં માત્ર બે દિવસમાં જ ૬૨૮ લોકોના મોત નિપજ્યા છે. ટુકમા કોરોના વાયરસ અટકવાનું નામ નથી લેતો... જેનું મુખ્ય કારણ છે કે રોગ માટેની રસી આજ દિન સુધી શોધી શકાય નથી. જો કે વિશ્વના વિકાસસીલ દેશોના વિજ્ઞાનીઓ અને ડોક્ટરો વાયરસને નાથવા માટેની રસી શોધવામાં મચી પડ્યા છે. પરંતુ હજુ સુધી સફળતા મળી હોય તેવા કોઈ

સમાચાર જાહેર થયા નથી. કોરોના વાયરસ એ હવાથી ફેલાતો રોગ નથી પરંતુ સ્પર્શ દ્વારા ફેલાતો રોગ છે. તેથી ગીચ વસ્તી હોય અને સ્પર્શ વધુ હોય લોકો એકબીજાના સંપર્કમાં વધુ પ્રમાણમાં આવતા હોય કે કોઈ યીજવસ્તુઓની આપ લે થતી હોય ત્યાં આ રોગ ઝડપથી ફેલાય છે. જો કોરોના એક જ જગ્યાએ ૧૨ થી ૧૪ કલાક પડી રહે તો તે આપોઆપ ખતમ થઈ જાય છે. અને એ જ કારણોસર આ બાબતે ઊંડા અભ્યાસ બાદ ભારતના વડાપ્રધાન મોદીજીએ ૨૨મીએ રવિવારે લોકોને ×લોકોની કેર માટે× જનતા કરફ્યુનો ૧૪ કલાકનું એલાન આપ્યું હતું. લોકોને ઘરમાંથી બહાર ન નીકળવા અનુરોધ કર્યો હતો. તે સાથે જેનાથી વાયરસ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકે છે અને અન્યોને ઝપટમાં લઈ લે એવું ન બને તે માટે દેશભરની ટ્રેઈનો, ટ્રાન્સપોર્ટ, વાહન વ્યવહાર પર સંપૂર્ણ પાબંધી મુકી દેવામાં આવી છે... જે પાબંધી આગામી તારીખ ૩૧ માર્ચ સુધી રહેવાની છે. તો પછી દેશભરમાં આ વાઈરસ વધુ ન ફેલાય તે માટે દેશના ૨૨ રાજ્યોના ૮૦ જિલ્લા લોક ડાઉન કરી દેવામાં આવ્યા છે... આના પરથી એક અંદાજ આવી શકે છે કે આ કોરોના વાયરસ માનવજાત માટે કેટલો ઘાતક છે.....? જોકે ૨૧જ કારણીઓ - ૨૧જ કીલ મહાનુભાવો કોરોના મુકી દેવા જોઈએ જેથી સરકારે જાહેર કરેલ નીતિ-નિયમોનું પાલન કરવાથી દૂર રહે છે...! જે અતિ ગંભીર બાબત છે... કાયદે વધારે માટે સમાન છે પણ.....!?

ભારતમાં વડાપ્રધાન મોદીજીએ જનતા કરફ્યુનો અમલ કરાવીને બહુ મોટું પગલું ભર્યું છે તેનો હકારોળ્યે સ્વીકાર કરવો જ રહ્યો..... જો એ રાહુલ ગાંધીએ કોરોના અનુસંધાનમાં જ ડ્રિવટ કરી હતી પરંતુ ભાજપના રાજનેતાઓ માટે તે ન ગણ્ય છે એટલે તેમની વાતનો અમલ કરવાથી દૂર રહ્યા.....! અન્ય બંધુ છે બધું ઉલટુ જેના કારણે લાગે છે કે ભાજપને માત્ર સત્તાપ્રાપ્તિ માજ રસ છે લોકોનું જે થવું હોય તે થાય.....! તેનો દાખલો છે મધ્યપ્રદેશના કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા ૨૨ ધારાસભ્યો જયોતિરાદિત્ય ૨૧જ કારણીઓ - ૨૧જ કીલ મહાનુભાવો કોરોના મુકી દેવા જોઈએ જેથી સરકારે જાહેર કરેલ નીતિ-નિયમોનું પાલન કરવાથી દૂર રહે છે...! જે અતિ ગંભીર બાબત છે... કાયદે વધારે માટે સમાન છે પણ.....!?

## લોકોને માર્ગ પરથી દૂર કરવા ઉતારાશે પોલીસ ફોર્સ, કરાશે કડક કાર્યવાહી કોરોના સામે સજાગ થાઓ, નહીં તો આંકડો લાખોમાં જશે: વિજય નહેરા

અમદાવાદ, તા. ૨૩ કોરોના વાઈરસને અટકાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સામાજિક મેળાવડા નહીં કરવા અપીલ કરી હતી. તેમજ કોરોના સામે લડતા લોકોનો જુસ્સો વધે તે હેતુથી રવિવારે સાંજે પોતાના ઘરની બાલ્કનીમાં થાળી, તાબા, ઘંટ, શંખનાદ કરવા આહ્વાન કર્યું હતું. આમ છતાં ખાડિયા વિસ્તારમાં ઘરમાં રહીને થાળી વગાડવાની જગ્યાએ લોકો રાજ્યવજ સાથે રેલી કાઢી હતી. રવિવારે જનતા કરફ્યુ દરમિયાન અનેક નાગરીકો દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી. જેના કારણે ૧૯ લોકો વિરુદ્ધ અટકાયત કરવામાં આવી છે. અમદાવાદી નાગરિકને ઘર બહાર ન નીકળવા એએમસીએ અપીલ કરી છે, તેમ છતાં અમુક લોકો જાણે પોતાની જાતને રાજા સમજીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવા લોકો પોતે જ મુશ્કેલીમાં મૂકાઈ છે, સાથે તેમના ઘરના લોકોને પણ મુશ્કેલીમાં મુકી રહ્યા છે. ત્યારે આજે કોરોનાના

શહેરની લડાઈ નિષ્ણાિક તબક્કામાં પહોંચી ગઈ છે. જેથી શહેરીજનોને આગામી ૨ અઠવાડિયા સુધી ઘરની બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવી છે. ૨ અઠવાડિયામાં શહેરીજનો કેવી જવાબદારી નીભાવશે તેના પર આખા શહેરનું ભાવિ ટેકું છે અને તેમણે ઉમેર્યું હતું કે, જો આપણે સાવધાની ના રાખી તો આગામી સમયમાં શહેરમાં હજારો અને લાખોની સંખ્યામાં દર્દીઓનો આંકડો વધી શકે છે. દરેક નાગરિકોએ જવાબદારી પૂર્વક પોતાની ફરજ નિભાવી સુચનાનું પાલન કરવા માટે જણાવ્યું છે. વિજય નહેરાએ વધુમાં જણાવ્યું કે, કોરોના સામે બાથ ભીડવા માટે તંત્ર સજ્જ છે, પરંતુ નાગરિકોએ પણ સાવધ રહેવું પડશે. જો તમે બહાર નીકળશો તો ચેપ તમને લાગશે અને તમારા થકી કોરોના વાયરસ તમારા ઘરમાં પહોંચી શકે છે. માટે નહેરાએ ઘરમાં બેસી રહેવા નાગરિકોને અપીલ કરી છે.

## ગુજરાત રાજ્ય બહારથી આવતી બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ પર ૩૧મી માર્ચ સુધી પ્રતિબંધ

ગાંધીનગર, તા. ૨૩ દેશભરમાં ફેલાઈ રહેલો કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને મહત્વાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય વાહન વ્યવહાર વિભાગના જણાવ્યાનુસાર, તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધી અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ગુજરાતમાં આવતી પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્ણયથી ગુજરાત રાજ્ય બહારથી આવતી તમામ પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ ગુજરાત રાજ્યમાં આજથી પ્રવેશી શકશે નહીં. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાં નોંધાયેલ ગુજરાત પાસિંગ પેસેન્જર બસો, ટેક્સી કેબ અને મેક્સી કેબ તા. ૨૫-૦૩-૨૦૨૦ સુધી રાજ્યની અંદર પણ મુસાફરોની હેરફેર કરી શકશે નહીં, પરંતુ કોરોના વાઈરસના નિયંત્રણની કામગીરીમાં રોકાયેલ ઈમરજન્સી - મેડિકલ સર્વિસીસ અને અંગત વપરાશ માટેના વાહનો અને સરકારી ફરજમાં રોકાયેલા વાહનોને આ નિર્ણયથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત રાજ્યમાં દરરોજ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની પેસેન્જર બસો દ્વારા મોટી સંખ્યામાં મુસાફરોની હેરફેર થાય છે. આ હેરફેરથી કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.


## ઈમરજન્સી સિવાય નીકળવું નહીં, ધ્યાન નહીં રાખો તો પસ્તાવાનો વારો આવશે: રૂપાણી

ગાંધીનગર, તા. ૨૩ આજે ગુજરાતમાં એક સાથે ૧૧ કેસ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે અને સાથે જ રાજ્યભરના શહેરોમાં જાણે લોકો લોકડાઉનના આદેશની ધોળીને પી ગયા હોય તેમ સવારથી જ જાહેર માર્ગો પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે. તેવામાં મુખ્યમંત્રી રૂપાણીએ જનતાને આ હેલ્થ ઈમરજન્સીને ગંભીરતાથી લેવા અને પિકનિકમાં નીકળી પડ્યા હોય તેમ જાહેર રસ્તા પર નીકળી ન પડવા કહ્યું હતું. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોમાં સવારથી જ લોકોના ટોળે ટોળા જાહેર રસ્તાઓ પર ઉમટી પડ્યા હતા. તેવામાં મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે લોકો સંયમ જાળવે અને ૩૧ સુધી સ્વેચ્છાએ જ ઘરમાં રહે અને નિયમનો ભંગ ન કરે. લોકો આ રીતે નીકળી પડે છે તેનાથી રોગનો વ્યાપ વધી શકે છે. સીએમ રૂપાણીએ જાહેર

## આપણા શહેર કે ગામને કોરોનાથી બચાવી શકાય ?

વિશ્વભરમાં કોરોના વાયરસની મહામારી સામે આવી છે ત્યારે ભારત પણ બાકાત નથી પરંતુ આજના દિવસે પણ ભારત માં મહાનગરોની સાથે ખૂબ જ ઓછી સંખ્યામાં કેટલાક નાના શહેરોને બાદ કરતાં મોટાભાગના નાના શહેર કે ગામમાં આ વાયરસના કેસ નથી જે આવનારા દિવસોમાં કેટલા આવી શકે તે આપણા હાથમાં છે સોશિયલ મીડિયામાં કેટલીકવાર ટીકા જોવા મળે છે કે ચીનમાં થયો ત્યારે ભારત સરકારે આમ કરવું જોઈતું હતું કે તેમ કરવું જોઈતું હતું હકીકત માં સરકારે જે કરવાનું હશે તે કર્યું જ હશે પરંતુ હાલ ના તબક્કે આપણે એમ સમજી શકીએ કે ભારતના મોટા શહેરો કે અન્ય રાજ્યમાં શું કરવું તે આપણો વિષય નથી અને આપણા હાથમાં પણ નથી આપણે આજે પાટણ કે મહેસાણા જેવા શહેરો અને નાના ગામડામાં આ વાયરસ આવતો અટકાવવા શું કરી શકે તે વિચારવાનો સમય છે આ માટે એકમાત્ર સચોટ ઉપાય છે તે ઉઠે

રહેવું કેમ કે ઉકાળો કદાચ ઈમ્યુનિટી વધારી શકે પણ સંક્રમણથી બચાવી શકે નહીં કેમ્પમાં લોકોનું ભેગા થવું સંક્રમણ વધારી શકે કોરોના થયો છે કે નહીં તે સેલ્ફ ટેસ્ટના કોઈ ડોક્ટરના વીડિયો ઉપર વિશ્વાસ ના કરી શકાય કેમ કે તે લક્ષણો છેલ્લા સ્ટેજ પહેલાં જ આવી શકે ત્યાં સુધી સંક્રમિત વ્યક્તિ પરિવાર સહિત કેટલાય લોકોને ચેપ લગાડી શકે છે આધ્યાત્મિક ગુરુના માદળિયા કે પ્રસાદી કોઈપણ સંજોગોમાં કામ નથી આવવાના ઉલટું તેવી વ્યક્તિ ઓવર કોન્ફિડન્સ થી સંક્રમિત થવાના ચાન્સ વધી જાય છે આપણે જે શહેરમાં છીએ ત્યાં જ પોતાના ઘરમાં આઈસોલેટ રહીને ગામડામાં જવાનું ટાળીને પણ ભારતના ગામડાઓને ચોકકસપણે વાયરસથી બચાવી શકીશું તેમાં કોઈ શંકા નથી. રો. બાબુભાઈ કે પ્રજ્ઞાપતિ એસ કે બ્લડ બેંક પાટણ



આ ૧ પુસ્તક છે જેનું નામ છે The Eyes Of Darkness 1981 માં બહાર પડી હતી તેમાં લખેલું છે કે કોરોના વાઈરસ ને ચીન ના પોતાના શહેર વુહાન ના ૧ લેખ માં બધાથી છુપાવીને બનાવ્યું હતું પછી ત્યાંની સરકાર તેને ઉપયોગ માં લેશે ગરીબ લોકો ની આબાદી ઘટાડવા અને પોતે સુપર પાવર બનવા માટે અને આ પુસ્તક માં કોરોના વાઈરસ નું નામ વુહાન ૪૦૦ ના નામ પર છે આ પુસ્તક માં પહેલે થી બતાવેલું છે કે ચીન આ વાયરસ નો ઉપયોગ બાધો લોકલકલ હથિયાર તરીકે કરશે લેખક, Dean Koontz પાના ન. 353, 356.

## લોકો ને લોકડાઉન વિશે આટલી માહિતી પહોંચાડો

આ લોકડાઉન મા ધ્યાન રાખવા જેવી બાબતો : ૧: ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડવાનો સમય હવે પુરો થઈ ગયો છે આ હવે ભારત અને કોરોના નો મામલો છે. તો કેન્દ્ર સરકાર જે પણ પગલાં ભરી રહી છે એમાં સરકાર ની મદદ કરો. ૨: તમે મર્દ છો એ બતાવવા માટે બહાર ફરવુ નહી- કોરોના તમારી સાથે નહીં લડે તે તમારી અંદર લડશે. તો વાઈરસ ને તમારા ઘરે પહોંચાડવા મા મદદ ન કરો. ૩: ઈટલી મા સરકારે લોકો ને ઘર મા રહેવા માટે રજા આપી અને લોકો એ પિકનિક મનાવી. (બહાદુર લોકો) આજે તે બહાદુર લોકો ને દફનાવવા માટે લોકો નથી. તો ઘરે રહી ને તમારા પરીવાર ને હિંમત આપો એ તમારી અસલ મર્દાનગી હશે. ૪: આજે ઈટાલી ના લોકો ઘર મા કેદ વીચારી રહ્યા છે કે ૨ અઠવાડિયા પહેલા આ બધુ ખબર હોત તો ઘર મા જ રહેત. ૨ અઠવાડિયા પછી તમારે શુ વીચારવુ છે તે તમારે આજે નક્કી કરવાનુ છે ૫: આપડી ગુજરાત સરકાર દ્વારા કોરોના સામે લડાઈ લડવા માટે અત્યંત ગંભીર અને ઉપયોગી પગલાં લેવામાં આવી રહ્યા છે ત્યારે સરકાર ના હાથ ને આપણો સાથ આપીએ અને ફક્ત ઘર મા રહી ને ગરવી ગુજરાત ને મદદ કરો. કોરોના સામે ની લડાઈ મા તમે એક સૈનિક છો. ૬: સૌથી મહત્વની વાત આજ સુધી કોરોના ના જોકસ ફોરવર્ડ કર્યા હવે આવા માહિતી વાળા મેસેજ નો વારો છે. અને હા દુધ, અનાજ ની તંગી છે એવી અફવા ના મેસેજ આવે તો મોકલવા વાળા ને સહેજ ભારપૂર્વક સમજાવવા ની જવાબદારી તમારી છે. ઘેટા બકરા ની જેમ આવા મેસેજ ફોરવર્ડ નો કરો. એક વાત યાદ રાખો આજે ઈટાલી મા એક પુત્ર અને પીતા બંને દાખલ હતા આજે પુત્ર ને ખબર નથી કે તેના પીતા ટ દીવસ પહેલા જ મરી ગયા છે તો આ મજાક ની વસ્તુ નથી. બાકી ના ડરો ના ડરાવો અને એક સૌથી મોટી અપીલ. રોજ નું રોજ ખાતા પરીવારો જો આજુબાજુ માં રહેતા હોય તો એ પરિવાર માટે પણ ભોજન ની વ્યવસ્થા કરીયે.. જય હિંદ - એક ભારતીય



ઇટલી સે આવી યહ તસ્વીર ને પૂરે વિશ્વ કો સ્ત4ધ કરવા યા. ઇટલી કે યહ દોનો પતિ- પત્ની જ્ઞાટર થે ઓર દોનો ને દિન રાત લગા કર ૧૩૪ મરોજો કો બચાયા! લેકિન યહુ ૮ વે દિન કોરોના વાયસસ સે બીમાર હો ગ્ઞ ઓર અલગ અલગ કમરે મેં શિડટ કર દિપ્ ગ્ઞ, જબ દોનો કો લગા કિ હમ બચ નહીં પાંગે દોનોં હોસ્પિટલ કે લાંજ મેં , યહુે હોકર મુદ્દબત ધરી નજરોં સે ઇક દૂસરો કો દેખા, ગલે મિલે ઓર આથ ઘંટે કે બાદ દોનોં મર ગ્ઞ ળાચિર અપને વતન કે લિપ્ યહુદ કો કિયા કરુબાં ન. હ્દય પૂર્વક નમન

# ખેડૂતોના પાક ધિરાણતી મુદત વધારી આપે સરકાર શાકભાજી પકવતા ખેડૂતો માટે પરિવહન વ્યવસ્થા ગોઠવે:ખેડૂત એકતા મંચ

હાલ કોરોના વાઈરસને કારણે ટપાલ-કુરિયર જેવા માધ્યમો બંધ હોવાથી ખેડૂત એકતા મંચ મીડિયાના માધ્યમથી સરકારને અપીલ કરે છે કે...

હાલ કોરોના વાઈરસને કારણે બજારો બંધ છે, એપીએમસી બજારો સાવચેતીના ભાગરૂપે બંધ રખાય છે, સરકાર જે ઘઉંની ખરીદી ટેકાના ભાવે કરવાની હતી તે પણ વિલંબમાં પડી છે. હાલ ખેડૂતો પાસે પોતાના શિયાળુ પાકો ઘઉં-જીરું તૈયાર પડ્યા છે પરંતુ એનું વેચાણ મુશ્કેલ છે. બીજા બાજુ સહકારી મંડળીઓ ખેડૂતો પાસેથી લીધેલા પાક-ધિરાણ ૩૧મી માર્ચ પહેલા ભરવા માટે દબાણ કરી રહી છે. બજારબંધી અને જિલ્લાબંધીને

કારણે હાલ પૈસાની વ્યવસ્થા કરવી ખેડૂતો માટે મુશ્કેલ છે.  
જો ૩૧ માર્ચે ધિરાણ ના સુલઠાવે તો એમને મળતો વ્યાજ-માફીનો લાભ નહીં મળે એવું મંડળીઓ જણાવી રહી છે. જો વ્યાજ માફી ના મળે તો પાક-ધિરાણ લેનાર એક એક ખેડૂતને ૭ હજારથી લઈને ૨૦ હજાર સુધીનું નુકશાન થવાની સંભાવના છે. ગયું વર્ષ વરસાદ લંબાવાને કારણે ખરાબ ગયું એ પછી હવે કોરોનાને કારણે ખેડૂતો પોતાનો શિયાળુ પાક વેચી શકતા નથી એવા સંજોગોમાં સરકાર તરત જ જાહેરાત કરે કે:

૧: ખેડૂતોને મુદત વીત્યે ધિરાણ ભરે તો પણ વ્યાજ-સબસિડીનો લાભ મળશે, એકતા મંચ.

# કોરોના વાયરસ સંદર્ભે પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ




બનાસકાંઠા બ્યુરો ગૌરવ પુરોહિત કોરોના વાયરસને લઈ પાલનપુર ખાતે આજે કલેક્ટરના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જેમાં બહારથી આવેલ હોમ ક્વોરોન્ટાઈનમાં રાખેલ વ્યક્તિ બહાર ફરતો દેખાય તો ફરીયાદ દાખલ કરી તેને સારવાર આપવા કલેક્ટરે અધિકારીઓને આદેશ કર્યો છે. પાલનપુર ખાતે કલેક્ટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને યોજાયેલ અધિકારીઓની બેઠકમાં તેમણે જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણમાં લોકો ન આવે તે માટે આપણે ખુબ મોટી સેવાનું કામ કરી રહ્યા છીએ. બનાસકાંઠા કલેક્ટરે

ભોજન વ્યવસ્થા, માસ્ક, સેનિટાઈઝેશન સહિત તમામ વ્યવસ્થા ગોઠવવામાં તેમણે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કોરોના વાયરસની પરિસ્થિતિના કંટ્રોલ માટે આરોગ્ય વિભાગની ૩,૦૦૦ ટીમો ઘરે ઘરે ફરી સર્વે કરી રહી છે. આ ઉપરાંત કલેક્ટર અને ઘરે ઘરે ફરી તલાટી અને શિક્ષકો પણ સર્વે હાથ ધરશે.

હોમ ક્વોરોન્ટાઈનમાં રખાયેલ વ્યક્તિઓના ઘર આગળ સ્ટીકર લગાવવાયા: જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયાએ જણાવ્યું કે, જે લોકો જિલ્લા બહારથી વતનમાં આવ્યા છે તેમને

# કોરોના વાયરસના લીધે ઉદભવેલી પરિસ્થિતિમાં રોટરી ક્લબ સંચાલિત સેવંતીલાલ કાંતિલાલ બ્લડ સેન્ટર દ્વારા અપાતી સુરક્ષિત બ્લડ સર્વિસ



તાજેતરમાં ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બ્લડ સેન્ટર દ્વારા તમામ રીતે સુરક્ષાના પગલાની સાથે પાટણમાં દર્દીઓ માટે રક્તની અછત ઉભી ના થાય તે માટે આયોજન કરવા કરવામાં આવ્યું છે રક્ત ના પૂરતા સ્ટોક સાથે આગામી સમયમાં કોઈપણ દર્દીને સામે જમા કરાયા સિવાય બ્લડ સમી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે સ્વૈચ્છિક રીતે જમા કરાવનાર દર્દીના સગા તથા કાયમી સ્વૈચ્છિક રક્તદાતાઓ તથા લોહી લેવા આવનાર દર્દીના તમામ સગા માટે બ્લડ સેન્ટરમાં પ્રવેશ સાથે જ સેનેટાઈઝર થી હેન્ડ વોશ ની સગવડ ઉપરાંત ઓનર કોચ તથા સીટિંગ એરિયાને જંતુ મુક્ત કરવાની કાળજી પણ રાખવામાં આવી રહી છે ધરતીકંપ પૂર રાહત જેવી કુદરતી આફત સમયે સેવામાં અગ્રેસર રોટરી ક્લબ પાટણ દ્વારા કોરોના મહા મારીના સમયમાં પણ ક્લબ દ્વારા સંચાલિત

# અરવલ્લી જિલ્લાના પેન્શનર શ્રીઓએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ માટે આવકવેરા સંબંધિત બાંહેધરી તેમજ માહિતી મોકલવા બાબત

નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના માટે મોડાસા - અરવલ્લી તિજોરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનર શ્રીઓએ આવકવેરાની જુની પધ્ધતિ અથવા નવી પધ્ધતિ મુજબ આવકવેરા માસિક પેન્શનમાંથી કપાત કરવા માટે તા. ૩૧-૦૩-૨૦૨૦ સુધીમાં તિજોરી કચેરી મોડાસા ખાતે બાંહેધરી પત્ર



આજ રોજ પાલનપુરના વોર્ડ નં.૮ માં કોરોના વાયરસના રક્ષણ માટે હોમિયોપેથી દવા નિ:શુલ્ક આપવામાં આવી તેમજ કોરોના વાયરસ વિશેની માહિતી આપી લોકો ને અપીલ કરવા માં આવી શક્ય હોય તો ઘર ની બાર ના નીકળવું માસ્ક નો ઉપયોગ કરવો વારંવાર હાથ સાબુ થી ધોવાનો આગ્રહ રાખવો આ તમામ માહિતી આપી નિ:શુલ્ક હોમિયોપેથીક દવા આપવા માં આવી ડૉ.જયેશભાઈ ગોસ્વામી કિશોર પુરોહિત,મિલન દરજા આ ત્રણે મિત્રો નું સરાનીય કાર્ય ને લોકો એ બિરદાવ્યું

# હિંમતનગર શહેરને કોરોના મુક્ત રાખવા ફોર્ગીંગ કરવામાં આવ્યું



સાબરકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ ફેલાવો ના થાય તે માટે ના અગમચેતીના પગલાના ભાગરૂપે હિંમતનગર નગરપાલિકા શહેરમાં કોરોના વાયરસ ન ફેલાય તે માટે શહેરના તમામ વિસ્તારોમાં ફોર્ગીંગ કરવામાં આવી રહ્યું છે.

સમગ્ર વિશ્વ કોરોના વાયરસનો સામનો કરી રહ્યું છે. આ ભયાનક મહામારી હાલ ભારત અને ગુજરાતમાં પ્રસરી રહી છે જેને નિયંત્રિત કરવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ વાયરસના હાલ ગુજરાતના અમુક જિલ્લાઓમાં

વાતાવરણમાં જ નાશ કરી શકાય અને તેનો ચેપ બીજા લોકોને ના લાગે તે માટે અગમચેતી અને સાવધાની રાખવામાં આવી રહી છે. આ ફોર્ગીંગ હિંમતનગર શહેરના તમામ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે. વધુમાં જણાવ્યું કે આ ફોર્ગીંગ હિંમતનગરના જુદા-જુદા વિસ્તારોમાં સવાર થી સાંજ સુધી ૩૧ માર્ચ સુધી સતત કરવામાં આવશે. આ ફોર્ગીંગથી આ ચેપી વાયરસથી હિંમતનગર અને સાબરકાંઠા જિલ્લાને મુક્ત રાખવા માટે વહિવટીતંત્ર પુરતા પ્રયત્નો કરી રહ્યું છે.

આ સાથે તેમણે જનતાને અપીલ કરી હતી કે જરૂરી ના હોય તો નાગરીકો ઘરે જ રહી વહીવટીતંત્રને સાથ સહકાર આપે જેથી આપણા જિલ્લાને કોરોના મુક્ત રાખી શકાય. કોરોના વાયરસથી ગભરાવાની કે ડરવાની જરૂર નથી, પરંતુ સાવધાની આવશ્યક છે.

# વરથુંની રિશીતાએ નેશનલ શિષ્યવૃત્તિ પરીક્ષામાં મેરીટ પ્રાપ્ત કર્યું



મોટી ઈસરોલ, અરવલ્લી જિલ્લાના મોડાસાની કે.એ.ન.શાહ

હાઈસ્કૂલ સંલગ્ન પ્રાથમિક વિભાગમાં ધો.૮ માં અભ્યાસ કરતી મોડાસા તાલુકાના વરથું ગામની જાગૃતિ અને રોહિત પ્રજાપતિની પુત્રી રિશીતા રોહિત કુમાર પ્રજાપતિએ નેશનલ મિન્સ કમ સ્કોરલરશીપ પરીક્ષામાં ૧૨૦ ગુણ મેળવી મેરીટ પ્રાપ્ત કરી ગામ અને પ્રજાપતિ સમાજનું ગૌરવ વધારતા તેણી અને પરિવારને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

લોક ડાઉન ને ગંભીરતા થિ લેવાની જરૂર છે, હજુય ઘણા લોકો કામ વગર બહાર નીકળી પોતાની તથા બિજાની જિંદગી જોખમ માં મૂકે છે. પોલીસ અને પત્રકાર મિત્રો પોતાની જિંદગી જોખમ માં મૂકી સમાજ માટે કામ કરી જે અપીલ કરે છે તેને સમજો.

બહુ થઈ મજાક આજે જે ન્યુઝ તેમજ સોશિયલ મીડિયા ના તમામ વિશ્લેષણ પછી અંદાજ આવ્યો કે અત્યારે કોરોના ની અસર જે આપણે હળવાશ કે મજાક માં લઈએ છીએ તે આપણી ઘેલણ જ છે. શુ તમને ગમશે કે તમારા ભાઈ બહેન દીકરા દીકરી કે કોઈ અંગત વ્યક્તિ અચાનક તમને છોડી જતા રહે અને એ પણ કેવી રીતે કે તમે એની સાથે છેલ્લી વાત પણ ન કરી શકો કે એમના શરીર ને અંતિમક્રિયા પણ ન કરી શકો. માટે હવે વેવલા વેડા બંધ કરી સરકાર ના નિર્દેશ નું પાલન કરો જરૂર વગર ઘરની બહાર ન નીકળો આ વાઈરસ નો અત્યારે એકજ ઉપાય છે કે તેને ફેલાતો રોકો. આ મેસેજ ને મજાક માં લઈ શકાય પણ જો જો પછી ક્યાંક એ સમય ન આવે કે અફસોસ કરવાનો સમય પણ જતો રહે.

# કોરોના વાયરસને પગલે સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી મુલતવી રહેતા અરવલ્લીના રજિસ્ટ્રાર કસ્ટોડીયન નિમાયા



રજિસ્ટ્રાર, ગાંધીનગરના આદેશ મુજબ તા.૨૦.૩.૨૦૨૦ના રોજ

મોટી ઈસરોલ સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘન વ્યક્તિ કમિટી સભ્યોની આગામી તા.૨૨મી માર્ચે યોજનારી ચૂંટણી વર્તમાન કોરોના કહેરના સંજોગોમાં રાજ્ય રજિસ્ટ્રાર, ગાંધીનગરના આદેશ મુજબ મુલતવી રાખવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘના કસ્ટોડીયન તરીકેનો ચાર્જ અરવલ્લી જિલ્લા રજિસ્ટ્રાર (સહકારી મંડળીઓ) આર.એ.મકવાણાએ

સાંભળી લીધો છે. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી આજે તા.૨૨ મીએ યોજાવાની હતી. આ સંઘમાં કેટલાક સભ્યો બિન હરીફ ચૂંટાયા પછી હજુ પાંચ તાલુકાના પાંચ ડિસ્ક્રેટરોની ચૂંટણી થવાની હતી. જેમાં ઈડર, હિંમતનગર, તલોદ, પ્રાંતિજ અને વડાલી તાલુકામાંથી એક એક પ્રતિનિધિ માટે ચૂંટણી યોજાવાની હતી. જે હવે મુલતવી રહી છે અને કસ્ટોડીયનની નિમણૂક કરવામાં આવી છે.

# જિલ્લાના તમામ ધરોનું ડોર ટુ ડોર સરવે હાથ ધરાયો.

સાબરકાંઠા જિલ્લા વહિવટીતંત્ર કોરોના વાયરસને લઈને તમામ સાવચેતીને ધ્યાને રાખીને પૂર્વ તૈયારી કરીને એકાદ મોડ પર સઘન કાર્યવાહી કરી રહ્યું છે. કોરોના વાયરસ જિલ્લામાં ન ફેલાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા લોકજાગૃતિ માટે ખાસ પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે જિલ્લાના તમામ તાલુકાઓમાં વહિવટીતંત્રના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર જઈને સરવે હાથ ધરાયો છે. જિલ્લા વહિવટીતંત્ર

# નાનાપોઠા ખાતે કેટલાક કિરાણા સ્ટોરો માં ખુલ્લેઆમ ઠંડાપીણાં નો વેપલો કરી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચા

વલસાડ : અજીત પટેલ સામગ્ર દુનિયામાં કોરોના વાઈરસ ના પગલે હાહાકાર મચી ગયો છે ત્યારે ગુજરાત સરકારે પણ કેટલાક ખાદ્ય ચીજવસ્તુઓને ધ્યાનમાં રાખી ઠંડાપીણાં, વલસાડ

વેપલાઓ કરી રહ્યા હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર આ બાબતે ધ્યાન દોરે અને એવા દુકાનદારો સામે કાયદાકીય પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી રહી છે.

# કોરોના વાઈરસથી બચવા ધરમપુરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસની અપીલ



વા.પૂ. શ્રી શરદભાઈ વ્યાસ, ધરમપુર

વલસાડ : અજીત પટેલ વલસાડ જિલ્લાના ધરમપુરના સુપ્રસિદ્ધ ભાગવત કથાકાર શરદભાઈ વ્યાસે કોરોના વાઈરસથી બચવા માટે સાવચેત રહેવાની જરૂરિયાત છે અને સાવચેત રહેવા માટેના પગલાંઓ બહુ સહેલાઈથી અમલમાં મૂકી શકાય છે, તેમ જણાવીયું છે. કોઈને પણ મળવાનું ટાળીએ અને અનિવાર્ય સંજોગોમાં કોઈને મળવાનું જ થાય ત્યારે નમસ્કૃતિથી અભિવાદન કરી અને અંતર રાખીને વાત કરીએ. દર કલાકે હાથ ધોવા જોઈએ. તાવ કે ખાંસી કે શ્વાસ લેવામાં તકલીફ પડે તો તુરંત ડોક્ટર પાસે જઈ તપાસ કરાવી લેવી જોઈએ. કોરોના માટે દરવાજા બંધ રાખવા તેની આંડ ઊભા રહી

કામ કરે જ છે, પરંતુ દરેક વ્યક્તિ સાવચેતીના પગલાંનો અમલ કરી રાજકીય સૌથી મોટો સહયોગ આપી શકે છે. રાજકીય સમાજની જે ચિંતા કરે છે, તેવી જ ચિંતા વ્યાસપીઠને પણ હોય છે. જેથી આ મહામારીને રોકવા માટે સર્વસંગના બહાને પણ લોકો ભેગા થાય તે અમને મંજૂર નથી. આવતા ૧૫ સુધી ધરમાં જ રહી સર્વસંગ કરીએ, ઈશ્વર બધું જ સાચું જ કરશે, સરકાર પણ તેના બનતા પ્રયાસ કરશે, પણ તેમાં સૌના સહકાર દ્વારા કોરોના વાયરસના ફેલાવને અટકાવવા માટે જે પ્રયાસો થઈ રહ્યા છે, તેમાં મેડીકલ સીસ્ટમ સહિત જેઓ સેવાઓ આપી રહ્યા છે, તેમને પણ તેમણે અભિનંદન પાઠવ્યાં છે.